

EDITORIAL

On Droupadi Murmu's election as India's 15th President

The election of Droupadi Murmu as India's 15th President is rich in symbolism. In the 75th year of the country's Independence, Ms. Murmu becomes the second woman to occupy the Rashtrapati Bhavan, and the first member of a tribal community to do so. Her membership of the Santal tribe is in focus. She has risen through the ranks in the Bharatiya Janata Party (BJP), and has shown a mind of her own during her stint as Governor of Jharkhand. Her election to the highest office of the country comes 101 years after two tribespeople were elected to legislative bodies in colonial India. Founding figures of the Republic were acutely cognisant of the disadvantaged position of the tribespeople and made special provisions such as the Fifth and Sixth Schedules of the Constitution. Jaipal Singh Munda, sportsman and tribal leader, was a prominent member of the Constituent Assembly who forcefully articulated the fears and hopes of tribespeople. In 2000, two States, Jharkhand and Chhattisgarh, were formed to give more focused attention to the concentrated tribal population in these regions. The Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act, passed in 2006. Ms. Murmu's election is a milestone in the journey of tribal empowerment.

No middlemen, use app to sell livestock

Centuries-old cattle fairs are passe. All cattle buying and selling will go digital when 36 lakh dairy farmers of Gujarat, who are part of home-grown dairy giant Amul's family, will do business through a cattle trading platform. With this, a breeder in Junagadh will be able to sell a newborn Gir or Kankrej calf to a dairy farmer in Kutch or Surat or buy Mehsani or Murrah buffalo online from north Gujarat from the comfort of his home. Amul's platform for online sale and purchase of bovines has been launched for all the dairy unions of the state that enjoy the biggest share in India's organized dairy cooperative sector. Five years ago Amul - the Gujarat Co-operative Milk Marketing Federation (GMMF), India's largest food products marketing organization and its 18 milk unions across the state - adopted a common software. "Now, the mother app currently has five lakh active users. Using the same platform we have integrated the 'Pashudhan' feature, through which Gujarat's dairy farmers can buy and sell their cattle. With this, the role of the middlemen will be eliminated," said GMMF's chief operating officer Jayen Mehta. By Sunday evening, more than 40,000 users had already checked out the 'Pashudhan' feature on Amul's app for milk producers.

400 trees illegally cut in 7 years

AHMEDABAD: While Ahmedabad city's tree cover is falling rapidly, the number of cases of illegal tree felling is on the rise, making the situation rapidly worse for citizens. The city civic body's figures reveal that in the last seven years, 400 trees have been illegally cut down in the city. The highest number of illegal tree felling cases, 100, was registered in 2021-22. Sources in the Ahmedabad Municipal Corporation (AMC) say that while urban centres should ideally have 15% tree cover, Ahmedabad city's tree cover stands at a meagre 4.66%. According to the Forest Survey of India's State of Forests Report 2021, the city's forest cover, which was 17.86 sq km a decade ago, has fallen to 9.41 sq km, a 48% decrease. Sources in the AMC's parks and gardens department, which has embarked on a drive to plant 2 lakh saplings in the city this



monsoon, said the department has started stringent action against offenders. Sources said offenders are fined Rs 27,000 for chopping down a tree. This amount includes Rs 1,000 for damaging the environment, Rs 1,000 as administration charges and Rs 2,500 per tree for planting 10 trees as compensation for the offence. AMC officials said the civic body allows trees to be Sports Complex, the civic body allowed the contractor to cut down 13 trees while 13 others were shifted and replanted. Some design changes were also made to save 11 trees. Jignesh Patel, director of AMC's parks and gardens department, said offenders are made to give an undertaking that they will plant 10 trees to compensate for every illegally cut tree.

Must Watch International Award Winning Series 'Love at Fifth Floor' on MX Player



Ahmedabad, Exploring a challenging narrative, the 5-episodic mini-series on MX Player, 'Love at Fifth Floor' deconstructs emotions through crowdfunder. Directed, written and produced by Aditi Banerjee, 'Love at Fifth Floor', the series features a stunning cast with Dilnaz Irani, Virginia Rodrigues and Rachna Gupta as the leading trio along with Vivek Kumar, Vibha Deep Chopra, Kafeel Jafri in pivotal roles. (19-8)

SHUBHAM POLYSPIN LIMITED

(CIN: L17120GJ2012PLC069319)
Registered Office: Block No. 748, Saket Industrial Estate, Near Kaneriya Oil Mill, Jethpura- Basantpura Road, Vill: Borisana, Taluka: Kadi, Dist. Mehsana - 382728 (Gujarat)
E-Mail Id: ankitt@shubhamgrp.co Website: www.shubhampolyspin.com

Particulars	(Rs. In Lakhs)		
	Quarter ended on 30-06-2022 (Unaudited)	Quarter ended on 30-06-2021 (Unaudited)	Year ended on 31-03-2022 (Audited)
Total Income from operations	1288.00	1293.71	5291.25
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	6.15	60.90	124.99
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	6.15	60.90	124.99
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	(2.88)	44.70	67.53
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(2.88)	44.70	67.53
Equity Share Capital	1102.00	1102.00	1102.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	261.35
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	(0.03)	0.41	0.61

Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. 2. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and on the website of the Company. (www.shubhampolyspin.com). 3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

FOR, SHUBHAM POLYSPIN LIMITED
ANIL D. SOMANI
MANAGING DIRECTOR (DIN: 06373210)

Maruti Infrastructure Limited

(CIN: L65910GJ1994PLC023742)
Regd. Office: 802, Summit Building, Opp. Ison Mega Mall, S. G. Highway, Ahmedabad, Gujarat-380015, India. Ph: 079-26860740, E-mail: maruti_infra@yahoo.com, Website: www.marutinfra.in

Sr No	Particular	(Rs in Lakhs except EPS)		
		Quarter ended 30-06-2022	Quarter ended 30-06-2021	31-03-2022
1	Total Income from Operations	352.82	171.54	2,550.70
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	8.67	(26.54)	84.17
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	8.67	(26.54)	84.17
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	7.69	(26.85)	51.57
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	7.69	(26.85)	51.57
6	Equity Share Capital (Face value of Rs. 10 each)	1,250	1,250	1,250
7	Earnings per share (of Rs. 10/- each) (for discontinued & continuing operation):			1,029.93
8	Basic:	0.06	(0.21)	0.41
	Diluted:	0.06	(0.21)	0.41

Note: 1. The above is an extract of the detailed format of Unaudited financial results for the quarter ended on 30th June, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited financial results for the quarter ended on 30th June, 2022 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the company i.e. www.marutinfra.in.

For Maruti Infrastructure Limited
Nimesh D Patel
Chairman & Managing Director
(DIN : 00185400)

ASHISH POLYPLAST LIMITED

Regd. Office: 501, Fortune Business Hub, Nr. Shell Petrol Pump, Service City Road, Ahmedabad-380060
Phone : 9099052582, 9825220977 E-Mail: ashishpolyplast@gmail.com
CIN : L17110GJ1994PLC021391


Sr. No.	Particulars	Quarter ended			Year ended
		30.06.2022	31.03.2022	30.06.2021	
1	Total Income from operations (net)	436.71	444.02	310.75	436.71
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items)	1.10	7.09	14.39	1.10
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and Extraordinary items)	1.10	7.09	14.39	1.10
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items)	(1.41)	(0.65)	11.24	(1.41)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(1.21)	(3.65)	11.50	(1.21)
6	Equity share capital (face value of INR 10)	339.75	339.75	339.75	339.75
7	Reserve excluding Revaluation Reserve			204.91	204.91
8	Earning per share (before and after extraordinary items) Basic & Diluted:	(0.04)	(0.02)	0.33	(0.04)

Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and also on the Company's Website www.ashishpolyplast.com. 2. Above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on August 12, 2022.

By order of the Board
Ashish D Panchal
Chairman & Managing Director
DIN : 00598209

Date :- 12.08.2022
Place :- Ahmedabad

Quote from ATUL Foundation on 75 years of Independence



Ahmedabad, The completion of 75 years of independence marks an important milestone in the history of our country; in the last seven plus decades, it has made a notable and steady progress, economically and socially. Of course, a lot more is possible and required to be done. Atul Ltd (Atul) was founded by a legendary Indian, Kasturbhai Lalbhai on September 05, 1947 (in 20 days of independence) to create wealth in rural India, generate large-scale employment and make the country self-sufficient in its requirements of chemicals. The history of Atul and its social work are closely linked to that of our country. As the Company

celebrates its 75 years of incorporation next month, it reaffirms its commitment to serve the society, in its own small way, in step with national priorities. (19-1)

WESTERN RAILWAY ENGINEERING WORK

Design, Chief Electrical Engineer (Construction), Western Railway, 1st Floor Station Building, Room No. 165, Churghata, Mumbai-400 020 invites offer through e-tender portal www.treps.gov.in for the following tender: Name of Work: Request for Proposal (RFP) for Appointment of Authority Engineer for providing project management services for "Design, Supply, Erection, Testing & commissioning of 220/132/5 KV Traction Substation, Sectioning post (SPS) and Sub sectioning post (SSP) (2 x 25 KV System Scott Connected Transformer) of Mumbai- Rattlam and Vadodra-Ahmedabad Section of Western Railway, under Raising of Speed up to 160 Km/h on BCT-NDLs route on EPIC mode". Tender No.: EL-CO-EP-02-PMS; NIT Cost (In Rs.): 3,43,08,336.00/-; Earnest Money Deposit (EMD in Rs.): 3,21,21,000.00/-; EMD closing on: 09.08.2022 at 11:00 Hrs. e-Bid opening date (Technical Bid): 16.08.2022 at 11:30 Hrs. Instructions to the bidders: 1. Only e-bids submitted online through e-tender portal will be considered. Please note that printed offers will not be entertained. 2. The date of tender, terms & conditions and scope of work are uploaded and are available in electronic format on our website www.treps.gov.in 0345
Link on our Facebook.com/WesternWY

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd. Printed at: Dharti Printers C-3, Shankar Chamber, Nr. Fada Chamber, Asharham Road, Ahmedabad-2. Published From: 37/ A, Rajkumar Chamber, Opp. Rami Vidyalaya, Laximpura, Gorva, Vadodara

PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED

(CIN: L24231GJ1995PLC024809)
Regd. Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad - 382481
Phone: +91 79 27495737 | Website: www.praveg.com | E-mail: cs@praveg.com

Particulars	(Rs. in lakhs, except per share data)		
	Quarter ended 30/06/2022	Quarter ended 30/06/2021	Year ended 31/03/2022
Revenue from Operations	2005.37	363.18	4524.96
Profit before exceptional items and tax	756.34	51.67	1657.79
Profit before tax	756.34	51.67	1657.79
Profit for the year	565.27	38.62	1224.20
Total Comprehensive Income (after tax)	565.27	38.62	1224.06
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve			911.82
Earnings per equity share (of Rs. 10 each) Basic and Diluted (Not Annualised)	3.06	0.21	6.62

Note: 1. The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on August 13, 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results. 2. Additional information on standalone financial results is as follows: (Rs. in lakhs, except per share data)

Particulars	(Rs. in lakhs, except per share data)		
	Quarter ended 30/06/2022	Quarter ended 30/06/2021	31/03/2022
Revenue from Operations	2005.37	363.18	4498.86
Profit before exceptional items and tax	756.36	51.84	1656.37
Profit before tax	756.36	51.84	1656.37
Profit for the year	565.29	38.79	1222.78
Total Comprehensive Income (after tax)	565.29	38.79	1222.64
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve			920.41
Earnings per equity share (of Rs. 10 each) Basic and Diluted (Not Annualised)	3.06	0.21	6.61

Note: 3. The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. 4. The full format of the standalone and consolidated financial results for the quarter ended June 30, 2022 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.praveg.com.

For Praveg Communications (India) Limited
Vishvukumar Patel
Chairman

ECS Biztech Limited

(CIN: L30007GJ2010PLC063070)
Registered Office: B-02, THE FIRST, ECS Corporate House, Behind Keshavnagar Party Plot, Off 132 Ft. Road, Vadajpur, Ahmedabad - 380015, Gujarat
Phone : +91-8980005048 || E-Mail : secretarial@eccorporation.com || Website: www.eccorporation.com

Sr. No.	Particulars	Standalone		Year ended	
		30-06-2022	31-03-2022	30-06-2021	31-03-2022
1	Total Income from operations	31,29,503	59,13,654	37,10,810	1,73,45,077
2	Other Income	6,35,822	8,63,621	69,687	26,37,691
3	Total Income (1+2)	37,65,325	67,77,275	37,80,497	1,99,82,768
4	Profit before Exceptional Items and Tax	1,02,583	36,94,658	(7,93,394)	24,27,627
5	Profit before Tax	1,02,583	36,94,658	(7,93,394)	24,27,627
6	Net Profit for the period	1,02,583	59,84,922	(7,93,394)	24,27,627
7	Total Comprehensive Income for the period	1,02,583	59,84,922	(7,93,394)	24,27,627
8	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share)	20,35,50,470	20,35,50,470	20,35,50,470	20,35,50,470
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised):				
	1. Basic (Rs.)	0.005	0.291	(0.039)	0.118
	2. Diluted (Rs.)	0.005	0.291	(0.039)	0.118

Note: 1. The above Un-audited Standalone financial results for the Quarter ended 30th June, 2022, have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 13th August, 2022 and the Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company. 2. The above is an extract of the detailed format of Standalone Un-audited Financial Results for the Quarter ended on 30th June, 2022 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2022 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.ecsbiztech.com.

For and on behalf of the Board
Vijay M. Mandora
Managing Director
(DIN: 00328792)

NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD

Regd. Office & Works : Plot No. 119-120, Santaj-Vadisar Road, At Santaj, Taluka : Katal Dist. Gandhinagar : 382721 Ph. No. 079-27498670

Particulars	(Rs. in Lacs)		
	Quarter ended 30/06/2022	Year ended 31/03/2022	Quarter ended 30/06/2021
Total Income from operations	499.97	1,251.72	181.92
Net Profit / (Loss) from ordinary activities after tax	10.35	0.63	16.86
Total Comprehensive Income for the period (Comprising profit for the period and Other Comprehensive Income for the period) after tax	10.35	0.63	16.86
Equity Share Capital	362.30	362.30	362.30
Earnings Per Share (of Rs. 10/- each)			
Basic:	0.29	0.02	0.47
Diluted:	0.29	0.02	0.47

Note: 1. The above is an extract of the detailed quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full result of the Quarterly Results is available on the stock exchange website (www.bseindia.com) and also available on the Company's website (WWW.NARMADADRIP.COM)

FOR, NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD
JITEN VRAJAL VAGHIA
WHOLE TIME DIRECTOR
(DIN : 02435557)

Place: Ahmedabad
Date: 13-08-2022

